

તા.૧૫/૦૯/૨૦૨૧

કોરોના સામે વેક્સિન રામબાણ ઈલાજ છે:

તા.૧૭/૦૯/૨૦૨૧ના રોજ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનના શુભ અવસરે મેગા વેક્સિનેશનનું આયોજન કરેલ છે. નાગરિકોએ વેક્સિનેશન લેવા પદાધિકારીઓની અપીલ

૧૦,૩૪,૩૯૭ નાગરિકોએ પ્રથમ ડોઝ અને ૪,૭૮,૮૪૦ નાગરિકોએ બીજો ડોઝ લીધેલ છે. તમામ લોકોએ વેક્સિનનો ડોઝ લઈને કોરોના સામે રક્ષા કવચ પ્રાપ્ત કરી લેવું જોઈએ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદાજુદા ૩૧ કેન્દ્રો પર કોવીશિલ્ડ અને બે કેન્દ્રો પર કોવેક્સિન રસી આપવામાં આવી રહી છે.



મેયર ડૉ.પ્રદિપ ડવ , ડે.મેયર, ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન , પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, ઇંડક સુરેન્દ્રસિંહ વાળા તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડૉ.રાજેશ્રીબેન ડોડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે , કોરોના સામે વેક્સિન રામબાણ ઈલાજ છે. શહેરના વધુ ને વધુ નગરજનો વેક્સિન લ્યે તે માટે

શરૂઆતમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની જુદી જુદી સામાજિક સંસ્થાને જોડી અનેક વેક્સિનના કેમ્પો કરવામાં આવેલ. જેના કારણે પ્રથમ ડોઝ ખૂબજ બહોળી સંખ્યામાં શહેરીજનોએ વેક્સિન લીધેલ છે.

હાલમાં, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા કેન્દ્રો પર વેક્સિન આપવામાં આવી રહી છે તા.૧૭/૦૯/૨૦૨૧ના રોજ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનના શુભ અવસરે મેગા વેક્સિન આપવાનું આયોજન કરેલ છે અને રાજ્ય સરકાર દ્વારા ૨૦,૦૦૦ વેક્સિનના ડોઝ આપવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ આરોગ્ય કેન્દ્ર સહિત ૩૧ કેન્દ્રો પર કોવીશિલ્ડ રસી આપવામાં આવે છે. જ્યારે બે કેન્દ્રો પર કોવેક્સિન રસી આપવામાં આવે છે. કોવીશિલ્ડ રસી પ્રથમ ડોઝ લીધા બાદ ૨૮ દિવસ થઈ ગયા હોય તેવા નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવે છે. જ્યારે કોવીશિલ્ડ જે નાગરિકોએ પ્રથમ ડોઝ લીધો હોય તેવા નાગરિકોને ૮૪ દિવસ થઈ ગયા હોય તેવા તમામ નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા ખુબજ જરૂરી છે. જેથી જે નાગરિકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે અને ૮૪ દિવસ થઈ ગયેલ છે તેવા તમામ નાગરિકોએ જરા પણ આળસ કર્યા વગર બીજો ડોઝ લઈ લેવા પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

રાજકોટ શહેરમાં ૧૮ થી ૪૪ વર્ષના ૪૫ મોટી વર્ષના ઉપરના તમામ લોકોના ૨ ડોઝ પુરા થાય તે ખુબજ જરૂરી છે. હાલમાં, વેક્સિનના કુલ ૧૫,૧૩,૨૩૭ ડોઝ લોકોને અપાઈ ચુક્યા છે; જેમાં ૧૦,૩૪,૩૯૭ નાગરિકોએ પ્રથમ ડોઝ અને ૪,૭૮,૮૪૦ નાગરિકોએ બીજો ડોઝ લીધેલ છે. તા.૧૭/૦૯/૨૦૨૧ના રોજ સરકાર દ્વારા વેક્સિનનો ખુબજ મોટો જથ્થો આપવામાં આવનાર હોય તો શહેરના નગરજનોને વેક્સિન લેવા પદાધિકારીશ્રીઓ દ્વારા અપીલ કરવામાં આવેલ.

(પી.એ. ટુ મેયર)